https://archive.org/details/bk864/page/n0/mode/1up

2006-06-03 -Charity Comm Order -Nanakdas Kaka Appointment Pirana (864)

All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

નાયબ ચેરિટી કમિશ્નરશ્રી, ચેરિટી કમિશ્નરશ્રીની કચેરી, ગુજરાત રાજય, અમદાવાદ સમક્ષ
(ઉપસ્થિત નાયબ ચેરિટી કમિશ્નરશ્રી, શ્રીમતિ વી. આર. દવે)

ફેરફાર રીપોર્ટ નં. : ૧૦૦૨/૨૦૦૨.

તથા

ફેરફાર રીપોર્ટ નં. : ૧૦૧૩/૨૦૦૨.

વિષય : બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ-૧૯૫૦ ની કલમ-૨૨ અન્વયે ફેરફાર રીપોર્ટ અંગે તપાસ.

સંદર્ભ : પી ઈમામશા બાવા રોજા સંસ્થાન કમિટિ.
ટ્રસ્ટ નોં. નં. ઈ/૭૩૮/અમદાવાદ.

ફેરફાર રીપોર્ટ નં. : ૧૦૦૨/૨૦૦૨.

અરજદાર :- શ્રી પટેલ ભીમજીભાઈ કરશનભાઈ
રે. અમદાવાદ.

-:: વિરૂધ્ધ ::-

સામાવાળા :- (૧) શ્રી મુસ્તફામીયાં પીર સાહેબ સૈયદ
(૨) શ્રી દીલાવર હુસેન મીરસાબમીયાં સૈયદ
રે. બન્ને અમદાવાદ.

અરજદાર તરફે એડવોકેટ શ્રી એ. જે. મેમણ.

સામાવાળા તરફે એડવોકેટ શ્રી એ. એસ. સૈયદ.

ફેરફાર રીપોર્ટ નં. : ૧૦૧૩/૨૦૦૨.

અરજદાર :- શ્રી સૈયદ નુરૂદ્દીન બડામીયાં
રે. અમદાવાદ.

-:: વિરૂધ્ધ ::-

સામાવાળા :- (૧) શ્રી ભીમજીભાઈ કરશનભાઈ પટેલ
(૨) શ્રી દેવરામભાઈ
રે. બન્ને અમદાવાદ.

realpatidar.com

https://archive.org/details/bk864/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

Real Patidar
Unravel Truth

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk864/page/n2/mode/1up

2006-06-03 -Charity Comm Order -Nanakdas Kaka Appointment Pirana (864)

realpatidar.com

નાયબ ચેરિટી કમિશ્નરશ્રી, ચેરિટી કમિશ્નરશ્રીની કચેરી, ગુજરાત રાજય, અમદાવાદ સમક્ષ
(ઉપસ્થિત નાયબ ચેરિટી કમિશ્નરશ્રી, શ્રીમતિ વી. આર. દવે)

ફેરફાર રીપોર્ટ નં. : ૧૦૦૨/૨૦૦૨.

તથા

ફેરફાર રીપોર્ટ નં. : ૧૦૧૩/૨૦૦૨.

વિષય : બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ-૧૯૫૦ ની કલમ-૨૨ અન્વયે ફેરફાર રીપોર્ટ અંગે તપાસ.

સંદર્ભ : પી ઈમામશા બાવા રોજા સંસ્થાન કમિટિ.
ટ્રસ્ટ નોં. નં. ઈ/૭૩૮/અમદાવાદ.

ફેરફાર રીપોર્ટ નં. : ૧૦૦૨/૨૦૦૨.

અરજદાર :- શ્રી પટેલ ભીમજીભાઈ કરશનભાઈ
રે. અમદાવાદ.

-:: વિરૂધ્ધ ::-

સામાવાળા :- (૧) શ્રી મુસ્તફામીયાં પીર સાહેબ સૈયદ
(૨) શ્રી દીલાવર હુસેન મીરસાબમીયાં સૈયદ
રે. બન્ને અમદાવાદ.

અરજદાર તરફે એડવોકેટ શ્રી એ. જે. મેમણ.

સામાવાળા તરફે એડવોકેટ શ્રી એ. એસ. સૈયદ.

ફેરફાર રીપોર્ટ નં. : ૧૦૧૩/૨૦૦૨.

અરજદાર :- શ્રી સૈયદ નુરૂદ્દીન બડામીયાં
રે. અમદાવાદ.

-:: વિરૂધ્ધ ::-

સામાવાળા :- (૧) શ્રી ભીમજીભાઈ કરશનભાઈ પટેલ
(૨) શ્રી દેવરામભાઈ
રે. બન્ને અમદાવાદ.

realpatidar.com

https://archive.org/details/bk864/page/n3/mode/1up

realpatidar.com

અરજદાર તરફે એડવોકેટ શ્રી આર. એ. સેજપાલ તથા શ્રી એ. એસ. સૈયદ.

સામાવાળા તરફે એડવોકેટ શ્રી એ. જે. મેમણ.

-:: ચૂ કા દો ::-

(૧) ફેરફાર રીપોર્ટ નં.૧૦૦૨/૨૦૦૨ ના અરજદારે નવેમ્બર-૨૦૦૨ ના અરસામાં ટ્રસ્ટના ગાદીપતિ ચેરમેન શ્રી કરશનકાકા ગુરૂ સવજીકાકાનું અવસાન થવાથી તેમનું નામ કમી કરી નવા વરાયેલા ગાદીપતિ શ્રી નાનજીકાકા ગુરૂ કરશનકાકાનું નામ દાખલ કરવા અંગે ફેરફાર રજૂ કરેલો છે.

(૨) ફેરફારના કામે નીચે મુજબના દસ્તાવેજી પુરાવા રજુ છે.

નિશાની-૧/૧ થી કરશનકાકા સવજીકાકાના મરણ પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ, નિશાની-૧/૨ થી તા.૨૪/૧૦/૨૦૦૨ ના ગુજરાત સમાચારમાં ટ્રસ્ટના કાર્યકારી ચેરમેન તરીકે ભીમજીભાઇ કે. પટેલે જાહેરાત છપાવ્યાંની ઝેરોક્ષ, નિશાની-૧/૩ થી સંદેશમાં આપેલ જાહેરાતની ઝેરોક્ષ, નિશાની-૧/૪ થી તા.૧૭/૧૧/૨૦૦૨ ના રોજ ટ્રસ્ટમાં થયેલ ઠરાવની મીનીટસ રજૂ કરેલ છે. નિશાની-૧/૫ થી તા.૧૭/૧૧/૨૦૦૨ ની કારોબારીના ઠરાવની નકલ રજૂ છે. જેમાં ઠરાવ નં.-૨ થી ગાદીવાળાકાકા તરીકે નાનજીકાકા ગુરૂ કરશનકાકાનો ઉલ્લેખ છે. આંક-૩ થી અરજદાર તરફે શ્રી એસ. એમ. ગલનું વકીલપત્ર રજૂ છે. આંક-૨ થી ફેરફારના સમર્થનમાં અરજદારે સોગંદનામું કરેલું છે. આંક-૪ થી સામાવાળાઓની વાંધા અરજી રજૂ છે. જેમાં પચાણકાકાની ગાદીવાળાકાકા તરીકે નિમણૂંક કર્યાનું જાહેર કરી નાનજીકાકાની નિમણૂંક અંગે કોઇ ફેરફાર રીપોર્ટ રજૂ કરેલો હોય તો તેઓને સાંભળવા હુકમ કરવા રજૂઆત કરેલ છે. આંક-૫ થી પક્ષકારોને નોટીસ કરેલ છે. આંક-૬ થી અરજદાર તરફે એડવોકેટ શ્રી એ. જે. મેમણનું વકીલપત્ર છે. જે હકીકતમાં ફેરફાર રીપોર્ટ નં.૧૦૧૩/૨૦૦૨ ના કામે રજૂ કર્યાનો ઉલ્લેખ છે. આંક-૭ થી અરજદાર તરફે વાંધેદારોના વાંધાઓ અંગે અરજદારનો લેખિત જવાબ રજૂ છે. અરજદારની રજૂઆત છે કે, સ્કીમની જોગવાઇ મુજબ ગુજરનારના શિષ્ય ગાદીવાળાકાકા બને છે. એક કરતાં વધુ શિષ્ય ગાદીવાળાકાકાના હોય, તો તેમાંથી એકની ગાદીવાળાકાકા તરીકે નિમણૂંક થાય. પરંતુ એક જ શિષ્ય હોય તો આપો આપ તે ગાદીવાળાકાકા બને છે. પચાણકાકાએ પોતે અમદાવાદ રૂરલ કોર્ટમાં પોતે પિરાણાં સંસ્થામાં સાધુ નથી. તેવું સોગંદનામું દી.મુ.નં.૫૭૬/૦૧ ના કામે રજૂ કરેલ છે. સૈયદ નુરૂદીન તેમાં પ્રતિવાદી હોવાથી સઘળી હકીકત જાણતાં હોવાં છતાં, દીવાની કોર્ટમાં મેટર વિચારાધીન હોવા છતાં પચાણકાકા ગાદીવાળાકાકા બને છે, તેવો ફેરફાર રીપોર્ટ રજૂ કરે તેનાથી તેમનો બદ

realpatidar.com

https://archive.org/details/bk864/page/n4/mode/1up

2006-06-03 -Charity Comm Order -Nanakdas Kaka Appointment Pirana (864)

realpatidar.com

આશય સાબિત થાય છે. તેમજ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થાય છે. પેઢીનામાની લીંક ચાલુ રાખવા પણ કરશનકાકાનું નામ ગાદીવાળાકાકા તરીકે દાખલ થાય તે જરૂરી છે. નાનજીકાકા ગાદીવાળાકાકા બન્યાં છે, અને સ્કીમની જોગવાઇ મુજબની વિધિ પણ થયેલી છે. તેથી વાંધાઓ રદ કરી ફેરફાર રીપોર્ટ મંજૂર કરવાં રજૂઆત કરેલી છે. આંક-૮ થી અરજદાર તરફે શ્રી એ. જે. મેમણનું વકીલપત્ર છે. આંક-૯ ના દસ્તાવેજી પુરાવા લીસ્ટ સાથે નિશાની-૯/૧ થી રે.દી.મુ.નં.૪૧૪/૯૫ સીવીલ જજ સી.ડી. પાલનપુરની કોર્ટમાં પથાભાઇ કરશનભાઇએ કરેલ સોગંદનામાની ઝેરોક્ષ નકલ રજૂ છે. નિશાની-૯/૨ થી અમદાવાદ રૂરલના સીવીલ જજ સીની. ડીવીઝનની કોર્ટમાં દી. મુ. નં.૫૬/૦૧ ના કામે દી.મુ.નં. ... રજૂ કરેલ છે. આંક-૧૧ થી અરજદાર તરફે પુરાવા લીસ્ટ રજૂ કરેલ છે. જેને આંકે પાડવા રજૂઆત કરેલ છે. આંક-૧૨ થી અરજદાર તરફે પુરાવા લીસ્ટ છે. આંક-૧૫ થી તા. ૧૯/૧૦/૨૦૦૨ ની કારોબારીની મીટીંગમાં ઠરાવ નં.-૧ થી ૪ ની ઝેરોક્ષ નકલ છે. જે ધ્યાને લેતાં કુલ આઠ ટ્રસ્ટીઓની હાજરીમાં ઠરાવ કરી કરશનકાકાના અવસાન અંગે શોક ઠરાવ, અંતિમ વિધિનો કાર્યક્રમ નક્કી કરવા, કાર્યકારી ચેરમેન તરીકે ભીમજીભાઇની નિમણૂંક કરતો તથા સંસ્થાના ટ્રસ્ટી રતિભાઇ કે. પટેલને નાણાંકીય લેવડ દેવડ માટે સત્તા આપ્યાનો ઉલ્લેખ છે. આંક-૧૬ થી તા.૨૨/૧૦/૨૦૦૨ ની કારોબારીની મીનીટસ છે. જેમાં ઉલ્લેખ કર્યા મુજબ કુલ આઠ ટ્રસ્ટીઓની હાજરીમાં તા.૧૯/૧૦/૨૦૦૨ ની મીનીટસને બહાલી આપવા અંગે ગાદીપતિ કમ ચેરમેનની ખાલી જગ્યાં ભરવા માટે સેવક તથા સતપંથી સમાજની સંયુક્ત સભા માટે સમય અને સ્થળ નક્કી કરી તા.૧૭/૧૧/૨૦૦૨ ના રોજ પીરાણાં સંસ્થામાં સામાન્ય સભા રાખવા તથા તે અંગે ગુજરાત સમાચાર, જનસત્તા, ગુજરાત ટુ ડે તથા કચ્છમિત્રમાં જાહેરાત આપવા તથા તે અંગેની સત્તા ભીમજીભાઇ કરશનભાઇને આપવા ઠરાવ કરેલ છે. તથા અંતિમ વિધિમાં કરેલ ખર્ચને બહાલી આપેલ છે. આંક-૧૭, ૧૮ થી ગુજરાત સમાચાર તથા સંદેશમાં તા.૨૨/૧૦/૨૦૦૨ ના રોજ ગાદીપતિ કમ ચેરમેનની નિમણૂંક માટે સાદાત પંથ તથા સતપંથ સમાજના અનુયાયીઓની સભા રાખવા જાહેરાત આપ્યાની ઝેરોક્ષ રજૂ છે. આંક-૧૯ થી નાનજીકાકા ગુરૂ કરશનકાકાએ ગાદીવાળાકાકા તરીકે પોતાની ઉમેદવારી નોંધાવવા અંગે કાર્યકારી ચેરમેનને અરજી કરેલી છે. જે અરજી મળ્યાં બદલ ભીમજીભાઇ કે. પટેલે સહી કર્યાનું માલુમ પડે છે. આંક-૨૦ થી પથાકાકા ગુરૂ સવજીકાકાએ તા.૧૬/૧૧/૨૦૦૨ ના રોજ કાર્યકારી ચેરમેનને ઉદેશીને મુખ્ય કાકા માટે ઉમેદવારી નોંધાવવા અરજી કરેલી છે. જેની ઉપર ઉલ્લેખ કર્યા મુજબ સંસ્થા કમિટિના

realpatidar.com

https://archive.org/details/bk864/page/n5/mode/1up

realpatidar.com

તા.૯/૧૨/૯૧ ના રોજ કરેલ ઠરાવ અનુસાર પેટા કાકામાંથી પચાણકાકાનું સસ્પેન્ડ કર્યાનો ઠેરો કરેલ છે. જેની નીચે ભીમજીભાઇ કે. પટેલની સહી છે. આંક-૨૧ થી તા.૧૭/૧૧/૨૦૦૨ ની કારોબારીની મીટીંગની મીનીટસની ઝેરોક્ષ રજૂ કરેલ છે. જેમા ઠરાવ નં.૧ થી તા.૨૨/૧૦/૨૦૦૨ ની કાર્યવાહીને બહાલી આપવા અંગે જનરલ સભાના મુદ્દાપેટા ગાદીવાળાકાકા તરીકે નાનજીકાકા ગુરૂ કરશનકાકાની નિમણૂંકને બહાલી આપેલી છે. તથા નાણાંકીય લેવડ-દેવડ માટે નાનજીકાકા કરશનકાકા તથા ટ્રસ્ટી ભીમજીભાઇ કરશનભાઇને સત્તા આપવી તથા સંસ્થાની માલીકીની મિલ્કતોમાં નાનજીકાકા ગુરૂ કરશનકાકાનું નામ દાખલ કરાવવા અંગે ઠરાવ કરેલા છે. આંક-૨૨ થી ટ્રસ્ટી શ્રી જેઠાભાઇ શીવાજીભાઇએ સંસ્થા જે ઠરાવો કરે તેમાં પોતે સંમત હોવાનું દર્શાવી શારીરિક પરિસ્થિતિને કારણે મીટીંગમાં હાજર રહેવા માટે અશક્તિ દર્શાવેલ છે. આંક-૨૪ થી ૨૭ ફોટોગ્રાફસ છે. આંક-૩૩ તથા ૩૪ થી તા.૧૮/૧૧/૨૦૦૨ ના ગુજરાત સમાચાર તથા સંદેશ પેપરમાં ૨૭ માં ગાદીપતિ તરીકે નાનજીકાકાની નિમણૂંક થયાનું તથા હર્ષ પૂર્વક પ્રસંગ પત્યાનું જાહેર કરેલ છે. આંક-૩૫ થી આચાર્ય નાનજીકાકા ગુરૂ કરશનકાકાએ ટ્રસ્ટી તરીકે તથા ગાદીપતિ તરીકે આપેલ સંમતિપત્ર છે.

આંક-૧૩ થી અરજદાર ભીમજીભાઇ કરશનભાઇની સોગંદ ઉપર જુબાની લીધેલી છે. આંક-૧૪ થી સ્કીમની છાપેલી નકલ છે. આંક-૨૮ થી સામાવાળા તરફે એડવોકેટ શ્રી એ. એસ. સૈયદનું વકીલપત્ર છે. આંક-૨૯ થી સામાવાળા તરફે રજૂ કરેલ અરજીથી જાહેર કરેલ છે કે, સામાવાળાને નોટીસ આપ્યા સિવાય એક તરફી પ્રોસીડીંગ્સ થયેલ છે, તે રદ કરવા માંગણી કરેલી છે. જેની ઉપર મારા પુરોગામી નાયબ ચેરિટી કમિશ્નરશ્રીએ હુકમ કરી સરતપાસ મુલતવી રાખવા હુકમ કરેલો છે. આંક-૩૦ ની અરજી સાથે પુરાવા લીસ્ટ રજૂ છે. આંક-૩૧ થી પાલનપુરના સીવીલ જજ સી.ડી. સમક્ષ રે. દિ. મુ. નં.૪૧૪/૯૫ ના કામે પચાણભાઇ કરશનભાઇએ કરેલ સોગંદનામાની ઝેરોક્ષ રજૂ કરેલ છે, જે સર્ટીફાઇડ નકલની ઝેરોક્ષ છે. તથા આંક-૩૨ થી દિ: મુ. નં.૫૭૬/૦૧ ની વચગાળાની મનાઇ અરજીની ઝેરોક્ષ છે. આંક-૩૬ થી બન્ને પક્ષકારોના એડવોકેટ ફેરફાર રીપોર્ટ નં.૧૦૦૨/૦૨ તથા ૧૦૧૩/૦૨ નો સંયુક્ત પુરાવો લેવા રજૂઆત કરેલી છે, જે ગ્રાહ્ય રાખવામાં આવેલી છે. આંક-૪૬ થી સામાવાળા તરફે પુરાવા લીસ્ટ રજૂ થયેલું છે. નિશાની-૪૬/૧ આંક-૭૩ થી અગાઉના ફેરફાર રીપોર્ટ નં.૮૯૧/૮૬ ના કામે રજૂ થયેલ આંક-૪ ની સર્ટીફાઇડ કોપી રજૂ કરેલી છે. નિશાની-૪૬/૨ આંક-૭૪ થી સંસ્થાના તા.૨૧/૭/૮૬ ના ઠરાવની મીનીટસ રજૂ કરેલ છે. નિશાની-૪૬/૩ આંક-૭૫ થી ઠરીથી

realpatidar.com

https://archive.org/details/bk864/page/n6/mode/1up

realpatidar.com

ઉપરોકત ઠરાવની નકલ રજૂ કરેલી છે. નિશાની-૪૬/૪ આંક-૭૬ થી પેટા કાકાઓને ક્રમવાર બેડી પહેરાવી તે અંગેનું લખાણ (ઝેરોક્ષ) છે. નિશાની-૪૬/૫ આંક-૭૭ થી તા.૧૫/૩/૬૯ ની સંયુકત મીટીંગની મીનીટસ રજૂ કરેલ છે. તથા તે માટે રજૂ કરેલ ફેરફાર રીપોર્ટ આંક-૧ ની નકલ સાથે સામેલ કરેલ છે. નિશાની-૪૬/૬ આંક-૭૮ થી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટના મેમોરેન્ડમ તથા રૂલ્સ, રેગ્યુલેશનની ઝેરોક્ષ રજૂ કરેલ છે. આંક-૭૯ થી તે ટ્રસ્ટની નોંધણીના હુકમની નકલ રજૂ કરેલ છે. આંક-૮૦ થી એફ/૨૩૮૪/અમદાવાદથી નોંધાયેલા ટ્રસ્ટના પી.ટી.આર.ની નકલ છે. નિશાની-૪૬/૯ આંક-૮૧ થી દિ. મુ. નં.૧૫૩/૯૪ અમદાવાદ ગ્રામ્યના સીવીલ જજ સી.ડી. સમક્ષના કામે પ્રતિવાદી તરીકે અરજદારે આપેલ જવાબની ઝેરોક્ષ (સર્ટીફાઇડની) જે વંચાણે લેતાં આ કામે કયાં આશયથી રજૂ થયેલ છે, તે માલૂમ પડતું નથી. આંક-૮૨ થી સીવીલ જજ (સી.ડી.) અમદાવાદ સમક્ષના દાવા નં.૫૯૫/૯૩ ના કામે વાદીએ આપેલ મનાઇ અરજીની સર્ટીફાઇડ નકલની હુકમ સહીતની નિશાની-૪૬/૧૧ આંક-૮૩ થી સંયુકત ચેરિટી કમિશ્નર, અમદાવાદ સમક્ષના ન્યાય પરચુ. અરજી નં.૩૫/૦૨ ના કામે આંક-૧૧ થી થયેલ હુકમની નકલ રજૂ કરેલી છે. આંક-૪૮ થી અરજદારે પોતાનો પુરાવો બંધ કર્યાનું જાહેર કરેલ છે. આંક-૪૯ થી સામાવાળા મુસ્તુફામીયાં પીરસાહેબ સૈયદનું સરતપાસ અંગેનું સોગંદનામું તથા તેની ઉપર કચેરી સમક્ષ થયેલ ઉલટ તપાસ છે. આંક-૫૦ થી સામાવાળા તરફે પુરાવા લીસ્ટ સાથે નિશાની-૫૦/૧, આંક-૮૪ તા.૧૭/૧૧/૨૦૦૨ ની સાધારણ સભાના ઠરાવની નકલ છે. જેમાં ઉલ્લેખ કર્યા મુજબ પચાણકાકા ગુરૂ તેવજીકાકાને ગાદીવાળાકાકા તરીકે બેસાડવાનો ઉલ્લેખ કરી આશરે ૩૧૯ સહીઓ લીધાનું માલૂમ પડે છે. નિશાની-૫૦/૨ આંક-૮૫ પચાણકાકાની અરજીની નકલ છે. નિશાની-૫૩/૨ થી ન્યાય પરચુ.અરજી નં.૩૫/૦૨ ની અરજીની નકલ રજૂ કરેલ છે. આંક-૬૧ થી કાન્તીદાસ ગુરૂ કરશનદાસના નામથી પક્ષકાર તરીકે દાખલ થવાં અંગેની અરજી રજૂ થતાં તા.૧૯/૪/૨૦૦૫ ના રોજ જરૂરી હુકમ કરવામાં આવેલો છે. આંક-૬૨ થી આંક-૬૧ ની અરજીના સમર્થનમાં સોગંદનામું, આંક-૬૩ થી આંક-૬૧ ના અરજદાર તરફે એડવોકેટ શ્રી આર. એ. સેજપાલનું વકીલપત્ર, આંક-૬૪ થી પુરાવા લીસ્ટ, નિશાની-૬૪/૧ થી ૬૪/૪ દસ્તાવેજી પુરાવા તથા ફોટોગ્રાફ, આંક-૬૫ થી ભીમજીભાઇ કરશનભાઇનો આંક-૬૧ ની અજી સબબ લેખીત જવાબ રજૂ છે. આંક-૬૮ થી સોગંદનામું રજૂ છે. આંક-૬૯ થી અરજદાર તરફે ફેરફાર રીપોર્ટના કામે લેખીત દલીલો, આંક-૭૦ થી સામાવાળા તરફે લેખીત દલીલો રજુ કરેલ છે. આંક-૭૨ થી

realpatidar.com

https://archive.org/details/bk864/page/n7/mode/1up

realpatidar.com

કેટલીક નકલો આંકે પાડવા રજૂઆત છે. જે અરજી મંજૂર કરવામાં આવેલ છે. ફેરફાર રીપોર્ટ નં.૧૦૦૨/૦૨ ના કામે ઉપર મુજબના દસ્તાવેજી પુરાવા રજુ છે.

(૩) ફેરફાર રીપોર્ટ નં.૧૦૧૩/૦૨ થી સૈયદ નુરૂદીન બડામીયાંએ કરશનકાકા ગુરૂ સવજીકાકાનું અવસાન થવાથી નામ કમી કરી તા.૧૭/૧૧/૨૦૦૨ ના રોજ સાદાત પંચ તથા સતપંથ સમાજની સંયુક્ત મીટીંગમાં તેમની જગ્યા ઉપર નીમાયેલા પચાણકાકા ગુરૂ સવજીકાકાનું નામ દાખલ કરવા રજૂઆત કરેલી છે. આંક-૨ થી અરજદારનું સોગંદનામું રજૂ છે. નિશાની-૧/૧ થી તા.૧૭/૧૧/૨૦૦૨ ના રોજ કરેલ ઠરાવની મીનીટસ રજૂ કરેલ છે. જેમાં ઉલ્લેખ કર્યા મુજબ ભીમજીભાઈ કરશનભાઈ દ્વારા સાદાત પંચ તથા સતપંથીઓની સંયુક્ત મીટીંગ બોલાવવામાં આવેલી હોવાથી જેમાં નીચે સહી કરનાર સભ્યો હાજર રહ્યાં છે. અને બહુમતિ સભ્યોએ ત્રણ પેટાકાકાઓ પૈકી પચાણકાકાની પસંદગી થયેલી હોઈ તેઓશ્રીને ગાદીવાળાકાકા નીમ્યાંનું જાહેર કરેલ છે. અને પચાણકાકાને પાઘડી પહેરાવી સૈયદ સમાજના આગેવાનોએ નિયમો મુજબ વિધિ કરેલી છે, અને મુખ્ય ગાદી ઉપર બેસાડવામાં આવેલ છે. ઠરાવની નીચે આશરે ૨૪૦ સભ્યોની સહીઓ કર્યાનું માલૂમ પડે છે. તથા બીજા ૩૧૬ સભ્યોની સહીઓ અલગ કાગળ ઉપર છે. આંક-૩ થી અરંજદાર તરફે એડવોકેટ શ્રી આર. એ. સેજપાલનું વકીલપત્ર છે. આંક-૪ થી અરજદાર ઉપરાંત અન્ય બે સૈયદોને નોટીસ કર્યાનું રેકર્ડમાં છે. આંક-૫ થી ભીમજીભાઈ કે. પટેલની વાંધા અરજી છે. આંક-૬ થી મુસ્તફામીયાંએ લેખિત જવાબ આપી જાહેર કરેલ છે કે, સદરહુ ફેરફાર મંજૂર થાય તો તેમનો કોઈ વાંધો નથી. આંક-૮ થી શ્રી ભીમજીભાઈ તરફે વિગતવાર લેખિત જવાબ રજૂ કરેલો છે. શ્રી ભીમજીભાઈએ જાહેર કરેલ છે કે, ટાઈપ લખાણ વાળા ઠરાવમાં ખાલી જગ્યાઓ ભરેલ છે. તેથી સાબિત થાય છે કે લખાણમાં જણાવેલ ઈબારત ઉપજાવી કાઢેલ છે. પસંદગી પામનાર ગાદીવાળાકાકાના ગુરૂ તરીકે ગુજરનાર ગાદીવાળાકાકા હોવાનું નામ જરૂરી છે. રજૂ કરેલ ફેરફારથી ગાદીવાળા કાકાનું નામ મીટાવવાનો અરજદારનો આશય હોઈ બદ આશય વાળો ફેરફાર રીપોર્ટ હોવાનું સાબિત થાય છે. અમદાવાદ રૂરલના સીવીલ જજ સી.ડી.ની કોર્ટમાં દિ. મુ. નં.૫૭૬/૦૧ ના દાવામાં પચાણકાકા પેટાકાકા નથી તેવું ડેકલેરેશન કરી દાદ માંગેલ છે. આ ઉપરાંત પાલનપુરના સીવીલ જજ સી.ડી.ની કોર્ટમાં દિ. મુ. નં.૪૧૪/૯૬ ના કામે પચાણકાકાએ સોગંદનામું કરી જાહેર કરેલ છે કે પોતે સાધુ થઈ ગયાં છે અને પીરાણાં સંપ્રદાયના ગુરૂ હોવાથી કંચન અને કામીનીનો સદંતર ત્યાગ કર્યો છે. તેવી હકીકતો સામાવાળાએ ખોટી ઉપજાવી કાઢેલી છે. તથા પોતે ઓમરગઢ મુકામે

realpatidar.com

https://archive.org/details/bk864/page/n8/mode/1up

realpatidar.com

રહે છે. વધુમાં શ્રી ભીમજીભાઇએ એવું પણ જાહેર કરેલ છે કે, પચાણભાઇ કરશનભાઇ તરીકે મજકુર પોતાને ઓળખાવે છે. તેથી સાબિત થાય છે કે અરજદારે સોગંદ ઉપર ખોટી રજૂઆત કરી છે. તેથી ફેરફાર રીપોર્ટ રદ થવા પાત્ર છે. આંક-૧૧ થી અરજદાર શ્રી નુરૂદીન બડામીયાંનું સરતપાસ અંગેનું સોગંદનામું રજૂ છે. અરજદારે સોગંદ ઉપર જાહેર કરેલ છે કે, તા.૧૩/૨/૩૧ ના રોજ કોર્ટ દ્વારા ટ્રસ્ટની સ્કીમ ઘડેલી છે. અને સ્કીમ પ્રમાણે વહીવટ કરવો ફરજીયાત છે. સંસ્થા સાથે જોડાયેલા સૈયદો ઇમામશા બાવાના વારસદારો છે. ધર્મના અનુયાયીઓ સતપંથીઓ તરીકે ઓળખાય છે. સ્કીમ મુજબ પુખ્ત ઉંમરનો સતપંથી જેનું મતદાર યાદીમાં નામ ન હોય અને ત્રણ વર્ષ લાગલગાટ રૂા.૨-૦૦ આપ્યાં નહીં તેવા સતપંથીને મત આપવાનો અધિકાર ન હોવાનું ઠરાવી સતપંથીઓ અંગે યોગ્ય વ્યાખ્યા કરવામાં આવેલી છે. તેથી તેવી યોગ્યતા ન ધરાવતા સતપંથીઓ ચૂંટણીમાં ભાગ લઇ શકે નહીં કે સંસ્થાના હોદ્દેદારો બની શકે નહીં. સંસ્થાની મિલકતોનો વહીવટ કરવાં સ્કીમ પ્રમાણે સંસ્થા કમીટીની નીમણૂંક કરવા પ્રબંધ છે. કમીટીમાં સાત સતપંથી, ત્રણ સૈયદો અને એક ગાદીવાળાકાકાનો સમાવેશ થાય છે. સતપંથીના સાત વિભાગોમાંથી એક એક સભ્ય ચૂંટાય છે. અરજદાર તા.૧૫/૩/૯૧ ની કમીટીના સભ્યની રૂઇએ હોદ્દેદાર છે. કમીટીની સમય મર્યાદા નિમણૂંકથી પાંચ વર્ષની છે. સ્કીમના કલોજ-૧૮ મુજબ સૈયદ પંચ અને કાકા સાહેબને પેટાકાકા પસંદ કરવાનો હકક છે. પેટાકાકાએ રૂા.૫-૦૦ થી રૂા.૫૦-૦૦ સુધી સૈયદને આપવા કે જે સૈયદ યોગ્ય વિધિ કરી સંસ્થામાં દાખલ કરશે. સંસ્થાના બધા કાકાઓએ બ્રહ્મચારી રહેવું પડશે. પેટાકાકાની નીમણૂંક કરવાની સત્તા વહીવટી કમીટીને નથી, તેમ હોદ્દા ઉપરથી દૂર કરવાની સત્તા પણ નથી. સ્કીમના પેરા-૨૨, ૨૪ તથા ૨૫ મુજબ ગાદીવાળા કાકાની ખાલી પડેલ જગ્યા ઉપર વધુમાં વધુ બે માસમાં સાદાત તથા સતપંથથી સંયુકત મીટીંગ બોલાવી કાકા સાહેબના વારસદાર અને પેટા કાકાની યાદીમાંથી પસંદગી કરવાનું ઠરાવેલ છે. નીમણૂંક પામેલા કાકાની આનુસંગિક વિધિ સૈયદોના હાથે કરવી જરૂરી છે. કરશનકાકા ગુરૂ સવજીકાકાનું તા.૧૯/૧૦/૨૦૦૨ ના રોજ અવસાન થયેલું છે. તેમની જગ્યાએ નાનજીકાકા ગુરૂ કરશનકાકાની નીમણૂંક બાબતે ભીમજીભાઇએ રજૂ કરેલ ફેરફાર રીપોર્ટ નં.૧૦૦૨/૦૨ ની હકીકતો ખોટી અને ઉપજાવી કાઢેલી છે. ભીમજીભાઇ સતપંથી તરીકેની લાયકાત ધરાવતા નથી. તેમને પરણાં સંસ્થા સાથે કોઇ હિત સંબંધ નથી. સદરહુ કામમાં ખોટી વાંધા અરજી આપી છે. તા.૧૪/૩/૯૧ બાદ નવી ચૂંટણી કે કમીટીની સમય મર્યાદામાં વધારો થયેલો નથી. અરજદારે વિનંતી કરેલી હોવા છતાં નવી ચૂંટણી માટે કાર્યવાહી થયેલી નથી. કમીટી સભ્ય

realpatidar.com

https://archive.org/details/bk864/page/n9/mode/1up

realpatidar.com

તથા ટ્રસ્ટની હેસીયતથી ભીમજીભાઇ કરશનભાઇએ ગાદીવાળા કાકાની નીમણૂંક માટે કરેલી કાર્યવાહી શરૂથી જ ખોટી છે. ભીમજીભાઇની કાર્યકારી ચેરમેન તરીકે નીમણૂંક કરેલી છે. પરંતુ તે કાર્યવાહી સ્કીમના પ્રબંધો વિરૂધ્ધની હોઇ રદ થવાને પાત્ર છે. કાર્યકારી ચેરમેનનો હોદ્દો સ્કીમમાં નથી. નાનજીભાઇ કરશનભાઇની સંસ્થાના પેટાકાકા તરીકે નીમણૂંક થયેલી નથી. પચાણકાકાની પેટાકાકા તરીકે નીમણૂંક થયાનું વાંધેદારોએ સ્વીકારેલ છે. પચાણકાકાની નીમણૂંક રદ કરવાનો કહેવાતો ઠરાવ ખોટો છે. ગાદીવાળા કાકાની નીમણૂંક માટે ગુરૂ શિષ્યની જોગવાઇ નથી. સંસ્થામાં પેઢીનામું રાખવામાં આવતું નથી. ગાદીવાળા કાકાની નીમણૂંક કરવાં ચેરમેનની હેસીયતથી બોલાવવામાં આવેલી નોટીસ ખોટી છે. કાર્યકારી ચેરમેન તરીકેની નીમણૂંકનો ઠરાવ રજૂ થયેલો નથી. તા.૧૭/૧૧/૨૦૦૨ ના રોજ સંયુકત મીટીંગ મળેલી નથી. મીટીંગમાં સૈયદો દ્વારા હિસ્સો લેવામાં આવેલો નથી. માત્ર હિત ધરાવતા સતપંથીઓ દ્વારા ખોટી કાર્યવાહી કરવામાં આવેલ છે. ફેરફાર રીપોર્ટ નં.૧૦૧૩/૨૦૦૨ માં રજૂ કરેલ પુરાવા મુજબ સંયુકત મીટીંગ બોલાવવામાં આવેલી છે. અને સર્વાનુમતે થયેલા ઠરાવ મુજબ પચાણકાકાની ગાદીવાળા કાકા તરીકે નીમણૂંક કરવામાં આવેલી છે. સૈયદોના હાથે ધાર્મિક વિધિ કરવામાં આવેલી છે. તેથી ફેરફાર રીપોર્ટ નં.૧૦૧૩/૨૦૦૨ ગ્રાહ્ય રાખવા પાત્ર છે. નાનજીભાઇની નીમણૂંકનો ઠરાવ કાયદેસરનો નથી. સૈયદો દ્વારા સમર્થન મળેલું નથી. તેથી અધૂરી નીમણૂંક હોઇ તેમની નીમણૂંક અંગેનો ફેરફાર રીપોર્ટ રદ થવા પાત્ર છે. નીમણૂંક થયાં બાદ કોઇ એજન્ડા વગર નીમણૂંક મંજૂર રાખવા કમીટીએ ઠરાવ કરેલ છે. ભીમજીભાઇ તેમજ તેમના મળતીયાઓ પાસે રોકર્ડ હોઇ ઠરાવ ઉપજાવી કાઢેલો છે. પચાણકાકાની અરજીના સંદર્ભમાં ભીમજીભાઇએ કરેલ કાર્યવાહી ખોટી છે. અરજી કમીટી સમક્ષ મુકેલી નથી. તેની ઉપર કોઇ ચર્ચા થઇ નથી. ચૂંટણી અધિકારીની નીમણૂંક ગાદીવાળા કાકા માટે થઇ નથી. સતપંથીઓનું મતદાર લીસ્ટ નથી. ખોટા ઇસમોને સતપંથીઓ તરીકે દર્શાવેલા છે. પચાણકાકાની નીમણૂંક સંયુકત સભામાં કરી છે. ઠરાવમાં સૈયદો અને સતપંથીઓની સહીઓ છે. સૈયદો દ્વારા વિધિ થયેલી છે. મીટીંગમાં પોતે હાજર હતા અને તમામ સહીઓ પોતાની રૂબરૂમાં થયાનું જાહેર કરેલ છે. સરતપાસમાં ઉપર મુજબની હકીકત અરજદારે જાહેર કરેલી છે.

(૪) ઉલટ તપાસમાં અરજદારે જાહેર કરેલ છે કે, ફેરફાર રીપોર્ટ નં.૧૦૦૨/૦૨ ના કામે લેખિત વાંધા લીધા નથી. આંક-૧૫ વાળો ઠારાવ તમામ ટ્રસ્ટીઓએ મંજૂર રાખેલો છે. આંક-૧૬ નો ઠરાવ ગાદીવાળા કાકાની નીમણૂંક અંગેની તારીખ, સ્થળ, સમય નકકી

realpatidar.com

https://archive.org/details/bk864/page/n10/mode/1up

realpatidar.com

કરવા અંગેનો હતો જે અરજદારની હાજરીમાં થયાનું તથા ઠરાવમાં પોતાની સહી હોવનું જાહેર કરેલ છે. જેના અનુસંધાને આંક-૧૭, ૧૮ ની જાહેરાત પ્રસિધ્ધ થયાનું સ્વીકારેલ છે. પચાણકાકા તથા રવજીકાકાને મીટીંગમાં બોલાવેલા નહીં હોવાથી તેમણે કોઇ વાંધો નહીં લીધાનું જાહેર કરેલ છે. વધુમાં એવું પણ જાહેર કરેલ છે કે, સંસ્થાના ચેરમેનની જાહેરાતના અનુસંધાનમાં રોજના કંપાઉન્ડની મીટીંગમાં હાજર હતાં. ટ્રસ્ટના ઠરાવમાં આ અંગે કોઇ નોંધ નથી અને નોંધ કરવાં રજૂઆત કરેલી નથી. ઠરાવનો ટાઇપ કરેલી મુસદ્દો સેવક કમીટીની મીટીંગમાં તૈયાર થયેલો. પી.ટી.આર.માં પોતાનું નામ ચઢેલું નહીં હોવાનું પણ જાહેર કરેલ છે. કોઇ વ્યક્તિ સતપંથી છે કે કેમ? તેનો નિર્ણય કરવાની સત્તા કમીટીને છે. તેનો સ્વીકાર કરેલ છે. પચાણકાકાની અરજી લઇને પોતે ગયાનું સ્વીકારેલ છે. આંક-૧૭, ૧૮ થી જાહેરાત આપી સંયુક્ત મીટીંગ બોલાવવામાં આવેલી હોવાનું જાહેર કરેલ

(૫) સાહેદ કાનજીભાઇએ આંક-૨૦ થી સરતપાસમાં અરજદારને સમર્થન કરેલ છે. ઉલટ તપાસમાં જાહેર કરેલ છે કે, સેવકો અને સતપંથીઓની મીટીંગ બાબતે જાહેરાત આપ્યાનું પોતે જાણતા નથી. મીટીંગ ભર્યાનું કે નાનજીકાકાની ગાદીવાળા કાકા તરીકે નીમણુંક થયાનું પોતે જાણતાં નહીં હોવાનુ જાહેર કરેલ છે. અન્ય સાહેદ પટેલ પચાણભાઇએ પણ આંક-૨૧ થી આંક-૨૦ ની હકીકત દોહરાવી છે. આંક-૨૪ થી અરજદાર તરફે પુરાવો બંધ કર્યાનું જાહેર કરેલ છે.

(૬) ઉપર મુજબ બંને ફેરફાર રીપોર્ટના કામે મૌખિક તથા દસ્તાવેજી પુરાવા રજૂ થયેલા છે. જે લક્ષમાં લેતાં મારી સમક્ષ નીચેના નિર્ણયાત્મક મુદ્દા ઉપસ્થિત થાય છે.

(૧) ફેરફાર રીપોર્ટ નં.૧૦૦૨/૨૦૦૨ મંજૂર કરવા પાત્ર છે?

(૨) ફેરફાર રીપોર્ટ નં.૧૦૧૩/૦૨ અંશતઃ મંજૂર કરવા પાત્ર છે?

(૩) શો હુકમ?

(૭) ઉપરોક્ત મુદ્દાઓ અંગે મારાં તારણો નીચે મુજબ છે.

(૧) હકારાત્મક, (૨) નકારાત્મક, (૩) આખરી હુકમ મુજબ.

(૮) <u>તારણો માટેના કારણો :-</u>

ચેરિટી કમિશ્નરશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદના તબદીલ હુકમ નં.૧૧/૨૦૦૬ તા.૧૦/૪/૨૦૦૬ અન્વયે આ કામનો નિકાલ મારે કરવાનો થાય છે. બંને કામોમાં આંક-૧ થી રૂમી કરવાં દર્શાવેલ કરશનકાકા ગુરૂ રવજીકાકાનું નામ ટ્રસ્ટી તરીકે નોંધાયેલું છે. ફેરફાર રીપોર્ટ નં.૧૦૦૨/૦૨ ના કામે નિશાની-૧/૧ થી રજૂ થયેલા મરણના

realpatidar.com

https://archive.org/details/bk864/page/n11/mode/1up

realpatidar.com

પ્રમાણપત્રને આધારે તેઓનું નામ કમી કરવા પાત્ર છે. અરજદાર રેકર્ડ ઉપરના ટ્રસ્ટી છે. બન્ને કામો કોન્સોલીડેટ થયેલાં હોઇ એક સાથે હુકમ જાહેર કરવાનો થાય છે. ટ્રસ્ટની સ્કીમ તા.૨૧/૫/૩૧ ના રોજ ફર્સ્ટ કલાસ સબ જજ શ્રી સી. સી. શાહ દ્વારા ઘડવામાં આવેલી હોવાનું બન્ને પક્ષોએ સ્વીકારેલ છે. ટ્રસ્ટના રેકર્ડમાં પણ તે મુજબની પરિસ્થિતિ હોવાનું માલૂમ પડે છે. સ્કીમ ઘડાયા બાદ સ્કીમની કોઇ જોગવાઇમાં પ્ર. અ. નં.૪૭/૬૮ થી થયેલ ફેરફાર સિંવાય કોઇ ફેરફાર થયાનું રેકર્ડમાં નથી કે આ કામે જાહેર થયેલું નથી. સ્કીમ બાદ ગાદીવાળા કાકાની નીમણૂંકની રીતમાં કોઇ ફેરફાર નથી.

(૯) સ્કીમ મુજબ ગાદીવાળા કાકા જયાં સુધી ગાદી ઉપર રહે ત્યાં સુધી ટ્રસ્ટી તરીકે રહે છે. ગાદીવાળા કાકાની જગ્યા કોઇ પણ કારણસર ખાલી પડે તો સૈયદ અને સતપંથીઓની સંયુકત મીટીંગમાં જગ્યા ખાલી પડયાંના બે માસમાં કરવા પ્રબંધ છે. આ નીમણૂંક પેટા કાકાઓમાંથી કરવામાં આવશે. પસંદગી થયા બાદ ચાલ્યાં આવતા રીવાજ મુજબ સૈયદોના હાથે વિધિ થશે. કાકા સાહેબને પેટા કાકા નીમવાનો હકક છે. સંસ્થાના બધા કાકાઓએ બ્રહ્મચારી રહેવું પડશે. કોઇ વ્યકિત સતપંથી છે કે કેમ? તેનો નિર્ણય કોર્ટ કરશે. ઉપર પ્રમાણેની સ્કીમની જોગવાઇ મુજબ કાકા સાહેબના અનુગામી નીમી શકાય છે.

(૧૦) સદરહુ કિસ્સામાં આચાર્ય શ્રી કરસનકાકાનું (નિશાની-૧/૧) અવસાન થયાનું માલૂમ પડે છે. રીપોર્ટીંગ ટ્રસ્ટીઓનું નામ રેકર્ડ ઉપર છે. તેથી કમી થતું નામ પી.ટી.આર.માંથી રદ કરવામાં કોઇ હરકત નથી. ફેરફાર રીપોર્ટ નં.૧૦૦૨/૦૨ ના કામે આંક-૧૭, ૧૮ મુજબ દૈનિક વર્તમાનપત્રમાં શ્રી ભીમજીભાઇ કે. પટેલ કે જેઓ રેકર્ડ ઉપરના ટ્રસ્ટી છે. તેઓએ જાહેર (નોટીસ) એજન્ડા બહાર પાડી સૈયદો અને સતપંથીઓની સંયુકત મીટીંગ બોલાવેલી હોવાનું બન્ને પક્ષોએ સ્વીકારેલ છે. આંક-૧૫ મુજબ શ્રી ભીમજીભાઇની કાર્યકારી ચેરમેન તરીકે નીમણૂંક કર્યાનું માલૂમ પડે છે. ઠરાવમાં ત્રેણેય સૈયદ પ્રતિનીધિઓની સહીઓ છે. કોઇ વાંધો લીધાનું ઠરાવમાં નથી. શ્રી નુરૂદીનની રજૂઆત મુજબ ઘડીભર માની લઇએ કે કાર્યકારી ચેરમેન માટે સ્કીમમાં જોગવાઇ નથી, તે હકીકત સ્વીકારવામાં આવે તો પણ ટ્રસ્ટીઓએ સંયુકત રીતે ઠરાવ કરી કાકા સાહેબની નીમણૂંક માટેની જવાબદારી શ્રી ભીમજીભાઇને સોંપેલી હોવાનું ઠરાવ જોતાં માલૂમ પડે છે. જે ઠરાવ બાબતે ટ્રસ્ટમાં કોઇએ વાંધો લીધાનું રજૂ થયેલ રેકર્ડ ઉપરથી માલૂમ પડતું નથી. આંક-૧૬ મુજબ તા.૨૨/૧૦/૨૦૦૨ ની મીટીંગમાં ઠરાવ કરી કાકા સાહેબની નીમણૂંક માટે તા.૧૭/૧૧/૨૦૦૨ ના રોજ સંયુકત સભા બોલાવવા તથા તે માટે ગુજરાત સમાચાર, જનસત્તા તથા ગુજરાત ટુ ડે અને કચ્છમિત્રમાં જાહેરાત આપવાનો ઠરાવ સૈયદ

realpatidar.com

https://archive.org/details/bk864/page/n12/mode/1up

realpatidar.com

કમિટિના ત્રણેય સભ્યોની હાજરીમાં થયાનું સાબિત થાય છે. આંક-૧૯ થી દાખલ થનાર (ફેરફાર રીપોર્ટ નં.૧૦૦૨/૦૨) નાનજીકાકાએ ગાદીવાળા કાકા તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આંક-૨૦ થી શ્રી પચાણકાકાની ઉમેદવારી છે. જેની પર તેઓને પેટા કાકા તરીકે સસ્પેન્ડ કર્યાનો શેરો ભીમજીભાઈએ કર્યાનું માલુમ પડે છે. નાનજીભાઈની નીમણૂંક અંગે કુલ-૬ કમિટિ મેમ્બરોની હાજરીમાં ઠરાવ કરી નીમણૂંકને બહાલી આપેલી છે. આંક-૨૨ થી ગેરહાજર સભ્ય શ્રી પટેલ જેઠા શીવજીએ સંસ્થા કમીટીના સભ્યો જે કાર્યવાહી કરે તે પોતાને કબૂલ હોવાનું સ્વીકારેલ છે. આંક-૨૪ થી ૨૭ નાનજીકાકા કરશનકાકાની વિધિ અંગેના ફોટોગ્રાફ હોવાનું માલુમ પડે છે. આંક-૩૩ મુજબ તા.૧૮/૧૧/૦૨ ના ગુજરાત સમાચારમાં નાનજીકાકાની કાકા સાહેબ તરીકે પસંદગી થયાનું જાહેર કરેલ છે. આંક-૩૪ થી સંદેશ પેપરમાં જાહેરાત આપેલ છે. આંક-૩૫ થી નાનજીકાકા ગુરૂ કરશનકાકાએ પોતાની સંમતિ આપેલી છે.

(૧૧) અરજદાર ભીમજીભાઈએ પોતાની સોગંદ ઉપરની જુબાનીમાં ગાદીવાળા કાકા માટે બે ઉમેદવારોની અરજી મળ્યાંનું જાહેર કરેલ છે. પચાણકાકાની અરજી બાબતે જનરલ સભામાં ચર્ચા થયાનું જાહેર કરેલ છે. તથા તેઓ સમાજમાં અપ્રિય હોવાનું પણ જાહેર કરેલ છે. જનરલ સભામાં નવ થી દસ હજાર પ્રતિનીધિઓ હાજર હતાં. કોઈએ વાંધો લીધેલો નહીં. પચાણકાકા હાજર રહેલાં નહીં કે તેમનો લેખિત વાંધો આવેલો નહીં. સૈયદો ગેરહાજર રહેલાં તેઓનો કોઇ લેખિત વાંધો આવેલો નહીં. સૈયદો ગેરહાજર હોવાથી સૈયદોના હાથે નિમણૂંક પછીની વિધિ થયેલી નહીં. તેવું પણ રેકર્ડ ઉપર જાહેર થયેલ છે.

(૧૨) ટ્રસ્ટની સ્કીમ ઘડવા અંગેનો હુકમ વંચાણે લેતાં એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે સૈયદો ઈમામશા બાવાના વારસદારો હોવાથી સતપંથીઓ તેઓને પોતાના ગુરૂ માને છે. પરંતુ સંસ્થામાં સતપંથીઓ સારો રસ ધરાવે છે અને સંસ્થાની મિલકતોની આવક સિવાયની આવક સતપંથીઓ મારફતે જ ઉભી કરાય છે. તેથી સતપંથીઓને ગાદીવાળા કાકાની નીમણૂંકના હકકમાંથી બાકાત કરી શકાય તેમ નથી. તેવું જે તે સમયે કોર્ટનું ઓબ્ઝર્વેશન છે.

(૧૩) આ કામે જાહેર થવા મુજબ સૈયદોની સરખામણીમાં સતપંથીઓની સંખ્યા અનેક ગણી છે. ટ્રસ્ટ કમીટીમાં સતપંથી સભ્યોનું પ્રતિનીધિત્વ વધુ સંખ્યામાં છે. કમીટીને સોંપવામાં આવેલી સત્તાઓ જોતાં "સંસ્થાનો યોગ્ય વહીવટ ચાલે અને જરૂર પડે તો અંદર અંદર કામની વહેંચણી કરવા" કમીટીને સત્તા મળેલી છે. જે સત્તા અનુસાર કમીટીએ સર્વાનુમતે ઠરાવ કરી ગાદીવાળા કાકાની નીમણૂંક અંગેની જવાબદારી ભીમજીભાઈ

realpatidar.com

realpatidar.com

કરસનભાઈને સોંપેલી હોવાનું માલૂમ પડે છે. અને તે માટે કમીટીમાં ઠરાવ થયાનું અને હાજર પ્રતિનીધિઓએ ઠરાવમાં સહીઓ કર્યાનું રેકર્ડ ઉપર છે. ટ્રસ્ટમાં કાર્યકારી ચેરમેન માટે જોગવાઈ ન હોય તો પણ કામની વહેંચણી કરવાની સત્તા ટ્રસ્ટ કમીટીને છે અને તે અનુસાર ભીમજીભાઈને ગાદીવાળા કાકાની નીમણૂંક અંગેની જવાબદારી કામની વહેંચણી તરીકે સોંપ્યાનું માલૂમ પડે છે. સંસ્થાનું હિત જોવાની કમીટીની ફરજ છે. કાકા સાહેબ અને સૈયદ પંચને પેટાકાકા પસંદ કરવાનો હકક છે. તેથી કહી શકાય કે પેટાકાકાની નીમણૂંક અંગેનો નિર્ણય લેવાની સત્તા સતપંથીઓને નથી. આમ છતાં હાલના તબકકે મારે પચાણકાકાની નીમણૂંક પેટાકાકા તરીકે કાયદેસર રીતે થયેલી છે કે કેમ? તે અંગે નિર્ણય લેવાનો નથી કે પચાણકાકાની પેટાકાકા તરીકેની નિમણૂંક રદ કરવા કમીટીને સત્તા છે કે કેમ? તે અંગે નિર્ણય લેવાનો રહેતો નથી. પરંતુ ઘડી ભર માની લેવામાં આવે કે પચાણકાકા પેટાકાકા છે, તો પણ ગાદીવાળાકાકા તરીકે તેઓની નીમણૂંક કાયદેસરની છે કે કેમ? તેટલો મુદ્દો તપાસી પચાણકાકાની નીમણૂંક અંગેની કાયદેસરતા ચકાસવાની થાય છે. નવા ગાદીવાળા કાકાની નીમણૂંક માટે ફેરફાર રીપોર્ટ નં.૧૦૦૨/૦૨ ના મુખ્યત્વે જે દસ્તાવેજી પુરાવા ઉપર આધાર રાખેલો છે. તે જોતાં અરજદારે સાધારણ તથા સૈયદ પંચની સંયુકત મીટીંગ બોલાવવા જાહેરાત આપ્યાનું આંક-૧૭, ૧૮ થી સાબિત થાય છે. તા.૧૭/૧૧/૦૨ ની મીટીંગનો ઠરાવ જોતાં જનરલ સભાએ બહુમતિથી ગાદીવાળા કાકા તરીકે નાનજીકાકાની નીમણૂંક કર્યાનો ઉલ્લેખ છે. પરંતુ જનરલ સભામાં ગાદીવાળા કાકા તરીકે બહુમતિથી નાનજીકાકા ચૂંટાયા હોય તો જનરલ સભાનો કોઈ ઠરાવ આ કામે રજૂ કરવામાં આવેલો નથી. ચૂંટણી દરમ્યાન કોઈને કામગીરી સોંપવામાં આવેલી હોય તો તે અંગે ઠરાવમાં કોઈ ઉલ્લેખ નથી. ચૂંટણી કમિશ્નરની નીમણૂંક કર્યાના આધાર નથી. આંક-૧૫, ૧૬ ના ઠરાવો જોતાં ગાદીપતિની નીમણૂંક થતાં સુધી કાર્યકારી ચેરમેન તરીકે ભીમજીભાઈની નીમણૂંક કરેલી છે. જેઓ ટ્રસ્ટી શ્રી ઉંમદાદઅલી સાથે સલાહ મસલત કરી તેવું ઠરાવેલ છે અને સંયુકત સભા માટે સ્થળ, સમય, તારીખ નકકી કરેલ છે. (આંક-૧૬ ની મીટીંગમાં થયેલ ઠરાવ સર્વાનુમતે મંજુર કરેલો છે.) અને દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપવાની કાર્યવાહી ભીમજીભાઈને સોંપવાનું માલૂમ પડે છે. આંક-૧૯ થી નાનજીકાકા ગુરૂ કરસનકાકા તથા આંક-૨૦ થી પચાણકાકા ગુરૂ સવજીકાકાની ઉમેદવારી માટેની અરજીઓ રજૂ થયેલ છે. આંક-૨૧, ૨૨ જોતાં સાતેય સતપંથી ટ્રસ્ટીઓએ નાનજીકાકા ગુરૂ કરસનકાકાની ગાદીવાળા કાકા તરીકેની નીમણૂંકને બહાલી આપ્યાનું માલૂમ પડે છે. પરંતુ સૈયદ કમીટી સભ્ય એક પણ હાજર નથી. તેથી

realpatidar.com

https://archive.org/details/bk864/page/n14/mode/1up

realpatidar.com

માલૂમ પડે છે કે સૈયદ પંચ અને સતપંથીઓ વચ્ચેના સંપના અભાવે ગાદીવાળા કાકાની નીમણૂંક બાબતે વિવાદ ઉભો થયેલો છે. સ્કીમથી તેમજ સ્કીમના હુકમથી લોકશાહી સ્પીરીટને જીવંત રાખવાનો જે પ્રયાસ છે, તે સ્પીરીટનો વધ કરવાની અત્રેથી મને કોઇ સત્તા પ્રાપ્ત થતી નથી. આ કામે રજૂ થયેલા પેપર્સ જોતાં સૈયદો તથા સતપંથીઓ પોતપોતાનું અલગ વર્ચસ્વ સ્થાપિત કરવાના પ્રયત્ન કરતાં હોય તેમ જણાય છે. અને તેથી જ અલગ અલગ મીટીંગો એક જ તારીખે એક જ સમયે ભરેલ છે. પરંતુ તેનાંથી ટ્રસ્ટનું અહિત થવાની સંભાવના વધી જાય છે. સાર્વજનિક ટ્રસ્ટોના નિયંત્રક તથા રક્ષક તરીકે ટ્રસ્ટ તથા તેની મિલકતોનું સાર્વજનિક હિત ન જોખમાય તે જોવાની મારી નૈતિક ફરજ છે. સ્કીમની કલમ-૬ જોતાં સાદાત પંચ તથા સતપંથી સભ્યોની સંયુકત મીટીંગમાં જ ગાદીવાળા કાકાની નીમણૂંક કરવાં આજ્ઞાર્થ પ્રબંધ છે. બન્ને પક્ષો વચ્ચે અણબનાવ હોય અને સંયુકત રીતે મળીને ગાદીવાળા કાકાની નીમણૂંક ના કરી શકે તેવી પરિસ્થિતિ હોય તો, પેટાકાકાઓની યાદીમાંથી ગાદીવાળા કાકા તરીકે નીમણૂંક કરવા માટે તટસ્થ ચૂંટણી કરી ચૂંટણી કમિશ્નર નીમી બેલેટ પેપર છપાવી ગુપ્ત મતદાન પધ્ધતિનો આશ્રય ટ્રસ્ટ કમિટિએ લેવો જોઇતો હતો અને લોકશાહી સ્પીરીટને જીવંત રાખવો જોઇતો હતો. તેમ કરવાને બદલે બન્ને પક્ષોના પ્રતિનીધિઓએ અલગ અલગ મીટીંગ ભરી અલગ અલગ પેટાકાકાની નીમણૂંક કરી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો નિરર્થક પ્રયાસ કરેલો છે. અને એક જ જાહેરાતના સંદર્ભમાં બે અલગ અલગ મીટીંગો ભરેલી છે.

(૧૪) આ કામે આંક-૭૫ થી રજૂ થયેલો કમીટીનો ઠરાવ જોતાં તા.૨૧/૬/૮૫ ના રોજ બન્ને પંથની જાહેર સભામાં સર્વસંમતિથી ગુજરનાર કાકાની નીમણૂંક થયેલી હોવાનો ઉલ્લેખ છે. સર્વસંમતિથી નીમણૂંક કરવામાં આવી હોય ત્યારે કેટલા સભ્યો હાજર/ગેરહાજર હતા, તેવો મુદ્દો તપાસવાનો રહેતો નથી. પરંતુ જયારે સદરહુ કીસ્સામાં બહુમતિનો સવાલ છે ત્યારે કેટલા સભ્યો હાજર/ગેરહાજર હતાં, કેટલી બહુમતિથી કોની નીમણૂંક કરવામાં આવી તથા કોને કેટલા મત મળ્યાં તે મુદ્દો અત્યંત અગત્યનો બની જાય છે. આંક-૭૬ થી જે તે સમયે વિધિ કરવામાં આવી હોવાનો નીર્દેષ છે. આંક-૭૭ થી તા.૧૫/૩/૬૯ ની સંયુકત મીટીંગની મીનીટસ રજૂ કરવામાં આવેલ છે. જેનાથી સામાવાળા એવું દર્શાવવા માંગે છે કે ભૂતકાળમાં ગાદીવાળા કાકાની નીમણૂંક આંક-૭૭ મુજબની પધ્ધતિથી કરવામાં આવેલી છે અને તે મુજબની પધ્ધતિ અખત્યાર કરવી જોઇતી હતી. સામાવાળાની સદરહુ રજૂઆત સાથે હું સંપૂર્ણ સહમત થાઉ છું. ટ્રસ્ટમાં વિવાદો ચાલતા હોય તો ટ્રસ્ટે ગાદીવાળા કાકાની નીમણૂંક માટે સંપૂર્ણપણે લોકશાહી પધ્ધતિ

realpatidar.com

https://archive.org/details/bk864/page/n15/mode/1up

realpatidar.com

અખત્યાર કરી ગાદીવાળા કાકાની ચૂંટણી કરવી જોઇતી હતી. ટ્રસ્ટે ફેરફાર રીપોર્ટ નં.૧૦૦૨/૦૨ ના કામે યોગ્ય રીતે એજન્ડા બહાર પાડયાનું આ કામે સાબિત થતું હોવા છતાં એજન્ડા મુજબ ચૂંટણી થયાનું અને ગાદીવાળા કાકા તરીકે બહુમતિથી નાનજીકાકાની નીમણૂંક કર્યાનું સાબિત કરવામાં અરજદાર સદંતર નિષ્ફળ ગયેલા છે. આંક-૭૮ થી ૮૦ ના પુરાવા આ કામે સુસંગત નથી. આંક-૮૧, ૮૨ ના દસ્તાવેજી પુરાવા અમદાવાદ સી.ડી. કોર્ટના રજૂ થયેલ દાવા અંગેના છે. જે કોર્ટ મેટર હોઇ તેવા દાવાઓ અન્વયે આગળ શું કાર્યવાહી થઇ તે અત્રેથી તપાસવાનું રહેતું નથી. આંક-૮૩ થી સંયુકત ચેરીટી કમિશ્નર, અમદાવાદ સમક્ષની ન્યાય પરચું. અરજી નં.૩૫/૦૨ ના કામે આંક-૧૧ થી તા.૧૫/૧૧/૨૦૦૨ ના રોજ કરેલ હુકમની નકલ રજૂ છે. જે અરજી ટ્રસ્ટની ચૂંટણી અટકાવવા અંગેની હોવાનું માલૂમ પડે છે. જે હુકમ વંચાણે લેતાં પાન નં.૧૦ ઉપર અરજદારોના કહેવા મુજબ ત્રણ પેટાકાકા હોવાનો તથા સામાવાળાના કહેવા મુજબ બે પેટાકાકા હોવાનો તથા ત્રીજા પેટાકાકા વિવાદાસ્પદ હોવાનો ઉલ્લેખ છે. અને વિવાદાસ્પદ કાકા તે પચાણકાકા છે. તેવો પણ ઉલ્લેખ છે. અને ઉપરોકત ન્યાય પરચુ. અરજીના કામના અરજદાર તે ફેરફાર રીપોર્ટ નં.૧૦૦૨/૦૨ ના વાંધેદાર છે. તેઓએ નાનજીકાકાને સંસ્થાના પેટાકાકા હોવાનું સ્વીકારેલું છે. તેવું ન્યાય પરચુ. અરજીનો હુકમ વંચાણે લેતાં માલૂમ પડે છે. આ કામે ઉલટ તપાસમાં પણ નાનજીકાકા તે કરશનકાકાના શિષ્ય હોવાનો સ્વીકાર કરેલો છે. આમ છતાં ગુજરનાર કાકા સાહેબના શિષ્ય જ ગાદીવાળા કાકા બની શકે તેવી અરજદાર શ્રી ભીમજીભાઇની રજૂઆત સાથે હું સંમત નથી.

(૧૫) આંક-૮૪ નો ઠરાવ વંચાણે લેતાં ભીમજીભાઇએ આપેલ જાહેરાતના સંદર્ભમાં ભરાયેલ મીટીંગમાં પચાણકાકાની નીમણૂંક કર્યાનો ઉલ્લેખ છે. ત્રણેય પેટા કાકાઓનાં નામો દર્શાવેલા છે. ભીમજીભાઇએ આવો ઠરાવ થયાનો ઇન્કાર કરેલ છે. સામાવાળા નુરૂદીન બડામીયાંએ ઠરાવ રજૂ કરેલો હોવા છતાં ઠરાવ કોણે લખેલો, મુસદો કોણે તૈયાર કરેલો તે પોતે જાણતા ન હોવાનું જાહેર કરેલ છે. ગાદીવાળા કાકાની નીમણૂંકને ટ્રસ્ટ કમીટીએ બહાલી આપવાની હોય છે, તે હકીકતનો સામાવાળાએ સ્વીકાર કરેલો છે. વધુમાં એવું જાહેર કરેલ છે કે, અરજદારે કિલ્લેબંધી કરેલી હોવાથી જઇ શકેલા નહીં પરંતુ કિલ્લેબંધી બાબતે સામાવાળાએ કાંઇ પોલીસ કેસ કે કોર્ટ કાર્યવાહી કરેલી હોય તો તેવો કોઇ આધાર આ કામે રજુ નથી કે કિલ્લેબંધી કરેલી હોવાનું સાબિત કરેલું નથી. મીટીંગની તારીખે ટ્રસ્ટની બે જનરલ મીટીંગો મળ્યાનું સામાવાળાએ સ્વીકારેલ છે. આવી બે અલગ અલગ મીટીંગો ભરવાની કે મનસ્વી ઠરાવો કરવાની બન્ને પક્ષમાંથી એક પણ પક્ષને

realpatidar.com

realpatidar.com

સ્કીમથી સત્તા પ્રાપ્ત થયેલી નથી. વધુમાં અરજદાર શ્રી ભીમજીભાઇએ ફેરફાર રીપોર્ટ નં.૧૦૦૨/૦૨ ના કામે સોગંદ ઉપરની જુબાનીમાં જાહેર કરેલ છે કે, નાનજીકાકા ગુજરનારના એક માત્ર શિષ્ય હોઇ ગાદીપતિ તરીકે મૌખિક વરણી કરવામાં આવેલી તથા મીટીંગમાં નવ થી દસ હજાર સભ્યો હાજર હતા. સદરહુ બાબતને ધ્યાને લેવામાં આવે તો નવ થી દસ હજાર સભ્યોની મીટીંગમાં મૌખિક બહુમતિ જાહેર કરવી અશક્ય છે. આટલા બધા સભ્યો પોતાનો મત સાથે જાહેર કરે તો સંમત/અસંમત સભ્યો કેટલા તેનો અંદાજ કાઢી શકાય નહી. તેથી મૌખિક બહુમતી મળ્યાની હકીકત સ્વીકારી શકાય તેમ નથી.

(૧૬) રેકર્ડ ઉપરથી માલુમ પડે છે કે સંસ્થા પાસે સતપંથીઓની યાદી નથી. સ્કીમ મુજબ [illegible] ની સ્કીમ સતપંથીઓને જમા કર્યાનો આધાર નથી. તેથી એવું ન માની લેવાય કે [illegible] નથી. સને [illegible] માં સ્કીમના હુકમ વખતે પણ સતપંથીઓની સંખ્યા અનેક ગણી હોવાનું ઓબ્ઝર્વેશન કોર્ટનું છે. અગાઉથી ચાલી આવતી પરંપરા અને પ્રથા મુજબ સતપંથીઓનું લીસ્ટ ન હોવા છતાં સતપંથીઓની હાજરીમાં ચૂંટણીઓ થયેલી છે. તેથી ફક્ત સતપંથીઓની યાદી ન હોવાના કારણસર તમામ સતપંથીઓને સંસ્થાની ચૂંટણીમાંથી બાકાત ન કરી શકાય કે પચાણજીકાકાની નીમણૂંક કરનાર સતપંથીઓ હતાં અને નાનજીકાકાની નીમણૂંક કરનાર સતપંથીઓ ન હતાં તેવું માની ન શકાય.

(૧૭) રેકર્ડ ઉપર જાહેર થયા મુજબ સંસ્થામાં હાલમાં એક વિવાદાસ્પદ પેટાકાકા સહિત ત્રણ પેટાકાકા છે. અને તેમાં નાનજીકાકા ગુરૂ કરશનકાકા તથા પચાણકાકા ગુરૂ સવજીકાકાનો સમાવેશ થાય છે. ગાદીવાળા કાકાની નીમણૂંક પેટાકાકાઓમાંથી કરવા જોગવાઇ છે. સને ૨૦૦૨ માં શ્રી નાનજીકાકાને ગાદીવાળાકાકા તરીકે નીમણૂંક થઇ ત્યારથી તેઓએ સંસ્થાનો વહીવટ ગાદીપતિ તરીકે કરેલો છે. તે બાબતે કોઇ પણ પેટાકાકાઓએ વાંધો લીધેલો હોય તેવું રેકર્ડ ઉપર નથી. પચાણકાકાએ સંસ્થાનો વહીવટ કર્યાનું માલુમ પડતું નથી. શ્રી નાનજીકાકા જનરલ સભામાં બહુમતિથી ચૂંટાયાનો કોઇ આધાર (સાધારણ સભ્યોની સહીઓ સાથેનો ઠરાવ) આ કામે રજૂ નહી હોવા છતાં તેઓએ સંસ્થાનો વહીવટ કરેલો છે તે હકીકતને લક્ષમાં રાખી શ્રી નાનજીકાકાનું નામ ડીફેક્ટો ટ્રસ્ટી તરીકે પી.ટી.આર.માં દાખલ કરવું ઉચિત જણાય છે. સામાન્ય રીતે કોઇ વ્યક્તિ કાયદેસરના હકક અધિકાર વગર કોઇ સંસ્થા/મિલકતનો કબજો મેળવે તો તે કાયદા માન્ય નથી. પરંતુ સાર્વજનિક ટ્રસ્ટની બાબતમાં સંસ્થા તથા તેના હિતાધીકારીઓનું અહિત ન થાય તે જોવાની મારી પ્રાથમિક ફરજ બને છે. સદરહુ કિસ્સામાં શ્રી

realpatidar.com

realpatidar.com

નાનજીકાકાએ સંસ્થાનો વહીવટ કરેલો કોઈ વહીવટકર્તા તરીકે સંસ્થાની મિલકતો અંગેની જવાબદારી નક્કી કરવા પણ તેઓનું નામ પી.ટી.આર. પર દાખલ કરવા પાત્ર છે.

(૧૦) ઉપરોકત તમામ બાબતોને લક્ષમાં રાખી નીચે મુજબનો આખરી હુકમ કરવામાં આવે છે.

:: હુ કમ ::

(૧) ફેરફાર રીપોર્ટ નં.૧૦૦૨/૨૦૦૨ નીચેની વિગતે મંજૂર કરવામાં આવે છે.

૧) કમી થતું નામ પી.ટી.આર.માંથી રદ કરી દાખલ થતું નામ ટીકેકટો ટ્રસ્ટી (કાકા સાહેબ) તરીકે દાખલ કરવુ.

(૨) ફેરફાર રીપોર્ટ નં.૧૦૧૩/૨૦૦૨ નામંજૂર કરવામાં આવે છે.

(૩) ટ્રસ્ટીઓએ હુકમ તારીખથી ૯૦ દિવસમાં યોગ્ય રીતે ચૂંટણી કરી પેટાકાકાઓમાંથી ગાદીવાળા કાકાની નીમણૂંક લોકશાહી પધ્ધતિથી કરવાની રહેશે અને ત્યારબાદ ૯૦ દિવસમાં ફેરફાર રીપોર્ટ રજુ કરવાનો રહેશે, જો તેમ કરવામાં કસૂર થશે તો ઉપરોકત સમય બાદ ટીકેકટો ટ્રસ્ટીનું નામ પી.ટી.આર માંથી રદ થશે.

ખર્ચ અંગે કોઈ હુકમ નથી. હુકમની જાણ અરજદારે તથા પક્ષકારોઓને કરવી. હુકમની બીજી પ્રત ફેરફાર રીપોર્ટ નં.૧૦૧૩/૨૦૦૨ ના કામે સામેલ રાખવી.

તારીખ ૩ / ૬ /૨૦૦૬
સ્થળ : અમદાવાદ.

[illegible]
નાયબ ચેરિટી કમિશ્નર
ચેરિટી કમિશ્નરશ્રીની કચેરી,
ગુજરાત રાજ્ય, અમદાવાદ.

[illegible]

realpatidar.com